

To, **BSE Limited** Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai - 400 001.

Dear Sir,

Sub: Newspaper Clipping - Extra Ordinary General Meeting dated September 30, 2023

Ref: Shish Industries Limited (Security Id/Code: SHISHIND / 540693)

Please find attached herewith the copy of newspaper notice informing about the Extra Ordinary General Meeting Notice / E-voting / Cut-off date as published in the requisite newspaper as per the requirement of Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Kindly take the same on your record

Thanking You,

Yours faithfully,

For, Shish Industries Limited

Vibha Khandelwal **Company Secretary**

Place: Surat

Date: September 9, 2023

GAUTAM GEMS LIMITED

CIN: L36911GJ2014PLC078802

Registered Add: 3rd Floor, Office-301, Surnukh Super CompOund, Vasta Devadi Road, Surat- 395004, Gujarat.

Phone: 912812538046 Email: complianceggl@gmail.com Web: www.gautamgems.com

NOTICE OF 10[™] ANNUAL GENERAL MEETING

otice is hereby given that the 10th Annual General Meeting (AGM) of the Members of Gauta

Gems Limited is scheduled to be held on Saturday, 30" September, 2023 at 12:00 PM through /ideo Conference ("VC") / Other Audio Visual Means ("OAVM) to transact the business as set out if he Notice of the 10" AGM, which is being circulated for convening the AGM. The Company has

already dispatched the Annual Report for the Financial Year 2022-23 along with the Notic convening 10° AGM through electronic mode to the Shareholders whose email address are egistered with the Company and / or Depositories in accordance with the Circulars issued by the full with the Company and Securities and Exchange Board of India. The Annual Report along

with the Notice of 10" AGM also available on the website of the company at www.gautamgems.co nd on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com.

As Per Section 108 of the CompaniesAct, 2013 read with Rule20 of the Companies (Management

and Administration) Rules, 2014, Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and the Secretarial Standards on General Meeting ("SS-2" issued by the Institute of Company Secretary of India, the Company is providing facility to all its Members to cast their vote on all resolutions to be set forth in the Notice of the AGM by electronic

means (e-voting) by using electronic voting system provided by the NSDL. The voting rights of the members shall be in the proportion to the equity share held by them in the paid up equity share of the Company as on Friday, September 22, 2023 (the "cut-off date"), The details are required.

ursuant to the provision of the Companies Act. 2013 and rules made thereunder are given below

The Book closure period shall commence on 24th September, 2023 and end on 30th September

The remote e-voting period will commence at 09:00 a.m. on Wednesday, September 27, 202 and will end at 05:00 p.m. on Friday, September 29, 2023.

Cut-off date for determining rights of entitlement of e-voting is Friday, September 22, 2023;

. The members will not be allowed to vote through remote e-voting beyond the period as specific

Shareholder acquiring the share of the company and becomes the members of the company after sending of the Notice and holding Shares as of the cut-off date may follow steps mention in the Notice of AGM to exercise their voting rights;

The Members who have cast their vote by remote e-voting prior to the AGM may als attend/participate in the AGM but shall not be entitled to cast their vote again.

The Board has appointed M/s. Neelam Somani & Associates, Practising Company Secretary to act as the Scrutinizer to scrutinize the e-voting procedure, who shall submit the results of voting

In case of any queries/grievances pertaining to remote e-voting you may refer to the Frequent Asked Questions ('FAQs') for Shareholders and e-voting user manual for Shareholders

2023 (both days inclusive);

to the Chairman.

CIN: L17290GJ2005PLC046345

Registered Add: 10 Mill Officers Colony, Behind Old Rbi, Ashram Road Ahmedabad Gj 380009

Phone: 079-26580767, Email: investor@rcspl.net Web: www.riddhicorporate.co.in

NOTICE OF THE 13™ ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND REMOTE E-VOTING INFORMATION

Notice is hereby given that the 13" Annual General Meeting (13" AGM) of the Members of Riddh Corporate Services Limited will be held on Thursday, 28" September, 2023 at 11:00 a.m. to ransact the business, as set out in the Notice of the 13" AGM. The Company has sent the Annual Report along with Notice convening AGM on Wednesday, 6" September, 2023, through electronic mode to all the Members whose e-mail IDs are registered with the Company's Registrar & Share Transfer Agent, M/S. PURVA SHAREGISTRY (INDIA) PVT. LTD/Depository Participant(s) in accordance with the Circular issued by the Ministry of Corporate Affairs dated 5" May, 2020 read with its circulars dated 8" April, 2020 and 13" April, 2020 and the Securities and Exchange Board India circular dated 12" May, 2020. The Annual Report along with the Notice convening the AGM is also available on the website of the Company at www.riddhicorporate.co.in, BSE Limited at www.bseindia.com and on the website of Central Depository Services (India) Limited (CDSL) at www.vsevinioridia.com.

ww.evotingindia.com. www.evolinglindus.com. Notice is also hereby given that pursuant to the provisions of section 91 of the Companies Act 2013; the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Friday 22" September, 2023 to Thursday 28" September, 2023 (both the days inclusive) for the purpose of 13" AGM of the Company.

Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Managemen)

Fursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, members are provided with the facility to cast their vote electronically through e-voting services provided by the CDSL on all resolutions as set forth in the 13th AGM Notice. The voting rights of the members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on Thursday, September, 21, 2023 ('cut-off date').

company as on inursoay, september, 21, 2023 (cut-off date). The remote e-voting period commences on Monday, 25° September, 2023 at 9.00 a.m. and will end on Wednesday, 27° September, 2023 at 5.00 p.m. During this period, the Members may cast their vote electronically. The remote e-voting module shall be disabled by CDSL thereafter. Those Members, who shall be present in the AGM and had not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM.

he manner of remote e-voting and voting at the AGM by members holding shares in lematerialized mode, physical mode and for members who have not registered their emai iddresses is provided in the Notice of the AGM.

Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company and holds shares as on the cut-off date; may obtain the login ID and password by sending a request to helpdesk.evoting@cdslindia.com. However, if he/she is already registered with CDSL for remote e-voting, then he/she can use his/her existing User ID and password for casting the votes. Registration of e-mail addresses:

Members whose email addresses are already registered with the Company/Depositories, may ollow the instructions for e-voting during the AGM as provided in the Notice of the AGM. Members whose email addresses are not registered with the Company/Depository may follow the below process for registering or updating their email addresses.

fembers holding shares in electronic/ Demat form, please update your email address with you Members noting shares in electronic Denna from please update your email address with your Depository Participants. However, Members may temporarily register the same with the Company's Registrar & Share Transfer Agent i.e. M/S PURVA SHAREGISTRY (INDIA) PVT. LTD at https://www.purvashare.com/email-and-phone-updation/on their website www.purvashare.com/ in the Register your Email id tab by providing details such as Name, DP ID, Client ID, PAN, mobile number and e-mail address.

In case of any queries pertaining to e-voting members may refer to the Frequently Asked Question ("FAQs") and the e-voting manual available at www.evotingindia.com, under help section or writ an email to helpdesk.evoting@cdslindia.com

Place : Ahmedabad Date: 6th September, 2023

FOR, RIDDHI CORPORATE SERVIES LIMITED sd/- MUSTAFA MUFADDALBHAI SIBATRA Compliance Officer & Company Secretary

available at www.evoting.nsdl.com under help section or co

રીજનલ ઓફિસ - આણંદ, દુકાન નં. ૨૨૨-૨૨७, બીજો માળ, મારૂતિ સોલારીસ, મધુબન રીસોર્ટ પાસે, આણંદ - સોજીત્રા રોક, આણંદ - ૩૮૮૦૦૧.

ct at 022-23058542/43

Managing Director (DIN: 06748854

FOR, GAUTAM GEMS LIMITED

sd/- GAUTAM P SHETH

વેચાણ નોટીસ સ્થાવર મિલકતો માટે વેચાણ

र्घ - हराञ्चनी नोटीस : **२**५.०૯.२०२३

સિકચોરીટી ઈલ્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ - ૨૦૦૨ નો નિયમ ૮(૬) ના પ્રોવિઝોની સાથે સિક્યુરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાલ્શીયલ એસેટ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી **ઇન્ટરેસ્ટ એક્ટ-૨૦૦૨ અન્વચે સ્થાવર મિલકતોનું ઇ - હરાજી વેચાણ માટે વેચાણ નોટીસ**. આથી જાહેર જનતાને તથા ઉધારકર્તાઓ અને જામીનદારોને વિશેષ રૂપથી નોટીસ આપવામાં આવે છે કે સિકયોર્ડ ક્રેડીટરને ગીરો મુકેલ નીચે દર્શાવેલ સ્થાવર મિલકતોનો **શુબિચન બેંક ઓફ ઇલ્ડિચા**ના અધિકૃત અધિકારી દ્રારા કબજો લેવાયેલ છે, નીચે દર્શાવેલ ઉધારકર્તાઓ અને જામીનદારો પાસેથી નીચે દર્શાવેલ બાકી લેણાંના વસુલાત હેતુ આવી મિલકતોનું "જ્યાં છે, જેમ છે અને જે કંઇ પણ છે" ના ધોરણે નીચે દર્શાવેલ તારીખે વેચાણ કરવામાં આવશે. અનામત કિંમત સાથે ઈએમડી ની રકમ પણ નીચે જણાવેલ છે.

ઝાણંદ શાખા : કાશી ધામ, મહર્ષિ દયાનંદ માર્ગ, આણંદ, જીલ્લો - ૩૮૮૦૦૧, શાખા મેનેજર : શ્રી પ્રમોદકુમાર ચાદવ (મો) : ૯૦૭૫૪૪૯૧૭૪ ાખાનું નામ અને સરનામું ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ શ્રી ઇરેનિયસ પોલ પો (ઉદ્યારકર્તા) અને શ્રીમતી પો કલ્પના ઇરેનિયસ (સહ-ઉદ્યારકર્તા) પ્રાકી લ્હેણી રકમ રૂા. ७,०७,०७२.५२, તા. ૩૧.૦૩.૨૦૨૧ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આદિન) તમામ ભાગ અને હિસ્સા સાથે દુકાન નં.૨૧૬, ક્રિષ્ના કોમ્પલેક્ષ, બેઝમેન્ટ માળ, આર.એસ.નં.૧૩૨૭/એ પૈકી સીટીએસ નં. ૨૧૯૨/બી/૧, મ્યુનીસીપલ નં.૧૨/૨/૧૩૭/૭, બોરસદ ચોકી, આણંદ, તાલુકો અને જીલ્લો આણંદ. ક્ષેત્રફળ : ૧૪.૮૬ સ્કે.મીટર. મિલકત નં. ૧ **ચતુઃસીમા**ઃ- **ઉત્તરે**ઃ દુકાન નં.૨૧૫**, દક્ષિણ**ં દુકાન નં.૨૧૭, **પૂર્વે**ઃ આણંદ-બોરસદ રોડ પછી માર્જીનની જગ્યા, **પશ્ચિમે**ઃ દુકાન. (સાંકેતિક કબજો) હરાજીની તારીખ અને સમય : ૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે 🌑 અનામત કિંમત : રૂા. ૫,૮૦,૦૦૦/- 👁 અનેંસ્ટ મની ડીપોઝીટ : રૂા. ૫૮,૦૦૦/-શ્રી કાનન વેઈંગ સિસ્ટમ્સ, પ્રો.શ્રી ભરતભાઈ જશભાઈ પટેલ (ઉદારકર્તા) અને શ્રી કમલેશભાઈ મોતીભાઈ પારેખ (સહ-બંદાનકર્તા / ઉદ્યારકર્તા/જામીનદારોનું ના

જામીનદાર) અને શ્રીમતી રેખાબેન ભરતભાઈ પટેલ (સહ-બંધનકર્તા/જામીનદાર) રૂા. ૨૮,૬૬,૬૦૫.૨૦, તા. ૩૧.૦૩.૨૦૨૧ + ચક્ત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આદિન) બાકી લ્હેણી રકમ તમામ ભાગ અને હિસ્સા સાથેનો સબ પ્લોટ નં.૭, સૂર્યાદિપ ટેનામેન્ટ, આર.એસ. નં. ૫૩૯/૧, + ૪, એફપી નં.૨૧, ટીપીએસ ૭ સતાવીસ ગામ સ્કુલ પાસે, ૮૦ ફીટ રોડ, આણંદ -૩૮૮૦૦૧, ક્ષેત્રફળઃ ૧૨૨.૫૦ સ્કે.મીટર, **ચતુઃસીમા**ઃ- **ઉત્તરે**ઃ રોડ, **દક્ષિછો**ઃ ટીપીએસ નં.૭ નો પ્લોટ નં. ૨૪,૨૫,૨*૬*, **પૂર્વે** भिલક्त नं. २ સૂર્યાદીપન નો એસ. પ્લોટ નં. ૬, પશ્ચિમે : સૂર્યાદીપન નો એસ. પ્લોટ નં. ૮. (સાંકેતિક કબજો) હરાજીની તારીખ અને સમય : ૨૬.૦૬.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે 🌑 અનામત કિંમત : રૂા. ૩૦,૮૫,૫૦૦/- 🌑 અર્નેસ્ટ મની ડીપોઝીટ : રૂા. ૩,૦૮,૫૫૦/-

શાખાનું નામ અને સરનામું	નડીયાદ શાખા : કર્મવીર ટાવર, કપડવંજ રોડ, નડીયાદ, ગુજરાત, શાખા મેનેજર : શ્રી સતેન્દ્ર આર્ચ (મો) : ૮૩૪૮૮७७०४			
ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ શ્રી વિનુભાઈ નાગજીભાઈ ભરવાડ અને શ્રી બાલાભાઈ નાગજીભાઈ ભરવાડ				
બાકી લ્હેણી સ્કમ રૂા. ૧૫,૯૪,૯૪૩.૮૬, તા.૩૦.૦૯.૨૦૧७ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આધિન)				
।। ।भलङत न. ३	તમામ ભાગ અને હિસ્સા સાથેનો પ્લોટ નં. એક /૧૧૧, કર્મવીર સુંદરવન-૩, કર્મવીર સુંદરવાટિકા-૧ પાસે, પ્રભુકુટિર સામે, મંજીપુરા રોડ, નડિયાદ, ગુજરાત પ્લોટ એરીયા - ફ૦૬ સ્કે.ફીટ થતુઃસીમા :- ઉત્તરે : પ્લોટ નં. એક/૧૧૨, દક્ષિણે : પ્લોટ નં. એક/૧૧૦, પૂર્વે : પ્લોટ નં. એક/૧૧૮, પક્ષિમે : સોસાયટી રોડ. (પ્રત્યક્ષ કબજો)			
eased angle and arrain	as as as an allow sould as as of the price of the state o			

GELGON THE OT OTHER . ES. OC. 1015 OTHE 11.00 OTHER 1.00 OTHER 1.01 OTHER 1.01 OTHER 1.01 OTHER 1.01 OTHER 1.01				
ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ	શ્રી ચિરાગ રાધવેન્દ્ર તિવારી અને શ્રી કાર્તિક રાધવેન્દ્ર તિવારી			
બાકી લ્હેણી રકમ રા. ૩૦,૦૨,૧૫૮, તા.૩૧.૦૧.૨૦૧७ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આધિન)				
મિલકત નં. ૪	તમામ ભાગ અને હિસ્સા સાથેનો ઘર નં. ૧૧૨, કર્મવીર સુંદરબાગ, તા. નડિયાદ, ગુજરાત, એરીયા ૭૫ સ્કે.મીટર. ચતુઃસીમા ઃ- ઉત્તરે ઃ એચ.નં.૧૧૧, દક્ષિષ્ટો ∶ સુંદરબાગ કંમ્પાઉન્ડવોલ પછીની બાઉન્ડ્રી, પૂર્વૅ ઃ એચ.નં.૯૭, પ શ્ચિમે ઃ સોસાયટી એપ્રોચ રોડ. (પ્રત્યક્ષ કબજો)			

કું. વિનીતાબેન જયક્રિયના ગાંધી અને શ્રી આશુતોષ ભાનુપ્રસાદ રાણા ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ બાકી લ્હેણી રકમ રૂા. ૨૫,૫૬,७૬૦/-, તા.૩૧.૧૦.૨૦૧७ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આદિન)

હરાજીની તારીખ અને સમય : ૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે ● અનામત કિંમત : રૂા. ૧૬,૩૧,૧૫૦/- ● અર્નેસ્ટ મની ડીપોઝીટ : રૂા. ૧,૬૩,૧૧૫/-

<mark>ચતુઃસીમાઃ- ઉત્તરે</mark>ઃ સોસાયટી એપ્રોચ રોડ, દક્ષિણોઃ ઘર નં, બી-૨૦, પૂર્વેઃ જમીનનો એસ.નં.૧૩૬/૨, પક્ષિમેઃ ઘર નં, બી-૨૨. (પ્રત્યક્ષ કબજો) હરાજીની તારીખ અને સમય : ૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે ● અનામત કિંમત : રૂા. ૧૬,૫૧,૫૫૦/- ● અર્નેસ્ટ મની ડીપોઝીટ : રૂા. ૧,૬૫,૧૫૫/-શ્રી પ્રતિકકમાર રાજેન્દ્રકમાર પટેલ અને ધારાબેન પ્રતિકકમાર પટેલ

ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ બાકી લ્હેણી રકમ રૂા. ૨૬,૯૨,૯૨૫/-, તા.૨७.૦૨.૨૦૧७ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આદિન) તમામ ભાગ અને હિસ્સા સાથે ઘર નં. ૮૨, કર્મવીરસુંદરબાગ, પીજ રોડ, ગામઃ ટંડેલ, નડિયાદ, ગુજરાત એરીયા ૭૫.૦૦ સ્કે.મી. **ચતુઃસીમા**ઃ- **ઉત્તરે** ઃ ઘર નં. ૮૩, દક્ષિણો ઃ ઘર નં, ૮૧, પૂર્વો ઃ સોસાયટી એપ્રોચ રોડ, પશ્ચિમે ઃ ઘર નં, ૯૫. (પ્રત્યક્ષ કંબજો) હરાજીની તારીખ અને સમય : ૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ ક્લાકે 🌑 અનામત કિંમત : રૂા. ૧૬,૩૧,૧૫૦/- 🜑 અર્નેસ્ટ મની ડીપોઝીટ : રૂા. ૧,૬૩,૧૧૫/-

શ્રી વિપુલ બાલકિષ્ના ભટ્ટ અને શ્રીમતી જાગૃતિ વિપુલ ભટ્ટ ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ રૂા. ૨૫,૯૯,૨૩७.૮૦, તા.૩૧.૦૭.૨૦૧७ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આદિન) બાકી લ્હેણી રકમ તમામ ભાગ અને હિસ્સા સાથે ઘર નં. ૧૭૨, કર્મવીરસુંદરબાગ, પીજ રોડ, ગામઃ ટંડેલ, નડિયાદ, ગુજરાત એરીયા ૮૦૭ સ્કે.ફીટ. <mark>ચતુઃસીમા ઃ- ઉત્તરે</mark> ઃ મિલકત નં. હ ઘર નં. ૧૭૧ **દક્ષિણે** ઃ ઘર નં, ૧૭૩, **પૂર્વે** ઃ ઘર નં, ૧૬૫, પશ્ચિમે ઃ સોસાયટી રોડ.(પ્રત્યક્ષ કબર્જો)

હરાજીની તારીખ અને સમય ઃ ૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે ● અનામત કિંમત ઃ રૂા. ૧૬,૩૧,૧૫૦/- ● અર્નેસ્ટ મની ડીપોઝીટ ઃ રૂા. ૧,૬૩,૧૧૫/-શ્રી યોગેશભાઈ રમેશભાઈ પંડયા અને શ્રીમતી ખુશ્બુ આર. પંડયા

રૂા. ૧૬,૦૨,૩૬૫/-, તા.૩૧.૦७.૨૦૧७ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આધિન) બાકી લ્હેણી રકમ તમામ ભાગ અને હિસ્સા સાથે પ્લોટ નં.એ/૧૬ પર ઘર, કર્મવીરનગર -VIII, નયા-બીલોદરા, ગામ-બીલોદરા, નડિયાદ, ગુજરાત. પ્લોટ એરિયા ૯૨૧ भिલકत नं. ८ સ્કે.ફીટ્સ, **ચતુઃસીમા**ઃ- **ઉત્તરે**ઃ કેનાલ, **દક્ષિણ**ઃ પ્લોટ નં.એ/૧૫, **પૂર્વે**ઃ એપ્રોચ રોડ, પ**શ્ચિમે**ઃ સર્વે નં. ૧૧૧ પૈકી ખેતીલાયક જમીન.(પ્રત્યક્ષ કબજો) હરાજીની તારીખ અને સમય : ૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ ક્લાકે 🖜 અનામત કિંમત : રૂા. ૧૦,૫૮,૨૫૦/- 🌑 અર્નેસ્ટ મની ડીપોઝીટ : રૂા. ૧,૦૫,૮૨૫/-

શ્રી કમલેશભાઈ રમેશભાઈ ચોહાણ અને શ્રીમતી સ્મીતાબેન કમલેશભાઈ ચોહાણ રૂા. ૨૧,૫૨,૫૯૦.૫૨, તા.૩૧.૦૧.૨૦૧७ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આધિન) બાકી લ્હેણી રકમ તમામ ભાગ અને હિસ્સા સાથે ઘર નં. ૨૩, કર્મવીરસુંદરબાગ, ટંડેલ, તા. નડિયાદ, ગુજરાત એરીયા ૬૦ સ્કે.મીટર, **ચતુઃસીમા** :- <mark>ઉત્તરે</mark> : એચ. નં.૨૨, **દક્ષિણ** : એચ. નં.૨૪, , **પૂર્વે** : સોસાયટી એપ્રોચ રોડ, **પશ્ચિમે** : એચ. નં.૧૮, .(પ્રત્યક્ષ કબજો) હરાજીની તારીખ અને સમય : ૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે ● અનામત કિંમત : રૂા. ૧૮,૨૩,૫૦૦/- ● અર્નેસ્ટ મની ડીપોઝીટ : રૂા. ૧,૮૨,૩૫૦/-

ઉત્તરસંકા શાખા : મધુકુંજ બિલ્કીંગ, શ્રીજી આર્થસ્કીમની પાસે, મેઇન રોક, તાલુકો - નકીયાદ, ઉત્તરસંકા, જીલ્લો - ખેકા, ગુજરાત - ૩૮७૩७૦, શાખા મેનેજર : શ્રી ઉપેન્દ્રકુમાર, (મો) : ૯૯૬૨૦૪૦७४ ાખાનું નામ અને સરનામં ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ શ્રી અનિલકુમાર નરોત્તમદાસ ઠક્કર (ઉધારકર્તા), શ્રીમતી ગીતાબેન અનિલકુમાર ઠક્કર (સહ - ઉધારકર્તા), પ્રાકી લ્હેણી રકમ રૂા. ૧७,૩૪,૮૩૯.૨७, તા. ૩૧.૦૩.૨૦૨૧ + ચક્ત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આધિન) તમામ ભાગ અને હિસ્સા સાથેનો ઘર ઈ-૨૧, કર્મવીર સુંદરવન - III, કર્મવીર વાટીકા -૧ પાસે, મંજીપુરા, તા. નડિયાદ, જીલ્લો - ખેડા. એરીયા ૭૫ સ્કે.મીટર. भिલક्त नं. १०

ચતુઃસીમા ઃ- ઉત્તરે ઃ પ્લોટ નં. ઈ/૨૨, **દક્ષિણે ઃ** પ્લોટ નં. ઈ/૨૦, **પૂર્વે ઃ** એપ્રોચ રોડ, **પશ્ચિમે ઃ** ઘર નં. ડી/૮૦. (પ્રત્યક્ષ કબજો) હરાજીની તારીખ અને સમય : ૨૬.૦૬.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે 🌘 અનામત કિંમત : રૂા. ૧७,૨૦,૪૦૦/- 🏶 અર્નેસ્ટ મની કીપોઝીટ : રૂા. ૧,૭૨,૦૪૦/-

ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ શ્રીમતી ભાવનાબેન પ્રદિપકુમાર કોરાની (ઉધારકર્તા), શ્રી પ્રદિપકુમાર પીતાંમ્બરદાસ કોરાની (સહ - ઉધારકર્તા), બાકી લ્હેણી રકમ રૂા. ૧૫,૯૫,૬૩૯.૨૨, તા. ૩૧.૦૩.૨૦૨૧ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આધિન) તમામ ભાગ અને હિસ્સા સાથેનો ઘર એક-૧૨૧, કર્મવીર સુંદરવન - III, કર્મવીર વાટીકા -૧ પાસે, મંજીપુરા, તા. નડિયાદ, જીલ્લો - ખેડા. એરીયા ૪૪ સ્કે.મીટર. મિલકત નં. ૧૧ ચતુઃસીમા ઃ- ઉત્તરે ઃ પ્લોટ નં. એક/૧૨૦, દક્ષિણો ઃ પ્લોટ નં.એક/૧૨૨, પૂર્વે ઃ ૬ મીટર એપ્રોચ રોડ, પશ્ચિમે ઃ પ્લોટ નં.એક/૧૦૮. (પ્રત્યક્ષ કબજો)

હરાજીની તારીખ અને સમય : ૨૬.૦૬.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે ● અનામત કિંમત : રૂા.૧૦,૬૬,૫૦૦/- ● અર્નેસ્ટ મની ડીપોઝીટ : રૂા. ૧,૦૬,૬૫૦/-ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ શ્રીમતી ગાયત્રી હર્ષદકુમાર પંચાલ અને શ્રીમતી પ્રિયંકા હર્ષદકુમાર પંચાલ રૂા. ૧૦,૦૩,૫૫૪.૫૫, તા. ૩૧.૦૮.૨૦૧૯ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આધિન) બાકી લ્હેણી રકમ તમામ ભાગ અને હિસ્સા સાથેનો ઘર એ/૧૩૬, કર્મવીર સુંદરવન, મંજીપુરા રોડ, નડિયાદ. બિલ્ટઅપ એરીયા ૧૨૪ સ્કે.મીટર. <mark>અતુઃસીમા :- ઉત્તરે</mark> : પ્લોટ નં. भिલકत नं. १२ એ/૧૩૫, દક્ષિણે : પ્લોટ નં.એ/૧૩૭, પૂર્વે : એપ્રોચ રોડ, પશ્ચિમે : પ્લોટ નં.એ/૧૩૩. (પ્રત્યક્ષ કબજો) હરાજીની તારીખ અને સમય : ૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે 🌘 અનામત કિંમત : રૂા.૨૩,૨૪,હ૫૦/- 🌘 અર્નેસ્ટ મની ડીપોઝીટ : રૂા. ૨,૩૨,૪७૫/-

કરાજી વેચાણના વિગતવાર નિયમો અને શરતો માટે બિડર્સને વેબસાઈટ : https://www.ibapi.in, and www.unionbankofindia.co.in ટેન્ડર પર જવાની સલાહ આપવામાં આવે છે નોંધણી અને લોગીન અને બિડીંગ નિયમો માટે મુલાકાત લો : https://www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp અધિકૃત અધિકારી, તારીખ : ૦૯.૦૯.૨૦૨૩ (અસલ અંગ્રેજી પરથી અનુવાદ) સ્થળ : આણંદ યુનિયન બેંક ઓફ ઇન્ડિય

(L15494GJ2013PLC073468)

🚜 环 NARMADA AGROBASE LIMITED Regd office: 613/P-1, IJ Pura (Jethaji) Dhanpura Road, Tal. Jotana, Mahesana Gujarat 384421 India

पश्जाहार Email: infonarmadaagrobase@gmail.com • website: www.narmadaagrobase.com NOTICE OF THE 11TH ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCING ("VC") OR OTHER AUDIO-VISUAL MEANS ("OAVM")

Notice is hereby given that the 11th Annual General Meeting of **NARMADA AGROBASE LIMITED** will be held on Saturday 30th September, 2023 at 11.30 A.M.

IST through video conferencing ("VC")/other Audio-Visual Means ("OAVM") Facility to transact the Ordinary Business, as set out in the Notice of the 11th AGM, in compliance with the applicable provisions of the Companies Act, 2013 and Rules framed thereunder and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with General Circular No. 20/2020 dated May 5, 2020 and subsequent Circulars issued from time to time and General Circular No 10/2022 dated December 28, 2022 read with relevant circulars issued by the Securities and Exchange Board of India (SEBI), from time to time (hereinafter collectively referred to as "Circulars)", has allowed the Companies to conduct the AGM through Video Conferencing (VC) or Other Audio Visual Means (OAVM) during the calendar year 2023. In Compliance with the provisions of the Companies Act, 2013 ("Act"), SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations") and MCA Circulars, the 11" AGM of the Company is being held through VC/OAVM.

In compliance with the aforesaid MCA Circulars and SEBI Circular, Notice of the AGM along with the Annual Report 2022-23 is being sent only through electronic mode to those Members whose email addresses are registered with the Company/ Depositories. Members who requires physical copy of the Annual-Report, may request for the same. Members may note that the Notice and Annual Report 2022-23 will also be available on the Company's website www.narmadaagrobae.com, websites of the Stock Exchanges i.e BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com. The Procedure / Instruction for e-voting and joining AGM are revided in the patiency of the ACM.

are provided in the notice of the AGM. The remote e-voting period commences on Wednesday, September 27, 2023 (9.00 A.M. IST) and ends on Friday, September 29, 2023 (5.00 P.M. IST). During this period, Members of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date of Friday, September 22, 2023, may cast their votes electronically. Members attending the AGM through VC/ OAVM, who have not cast their votes by remote e-voting shall be able to exercise their vote through e-voting during the AGM. The Members of the Company holding shares on the "cut-off date" of September 22, 2023 are entitled to vote on the resolutions proposed. The Members of the Company holding shares on the "cut-off date" of Sentember 22, 2023 are entitled to vote on the resolutions proposed. Members wishing to claim dividends that remain unclaimed are requested to correspond with the RTA mentioned above or the Company Secretary of the Company or at cs@narmadaagrobase.com.

Members are requested to notify immediately any change of their address and bank particulars and updating their emails and mobile nos to Depository Participants and in case their shares are held in dematerialised form, and to the Company if shares are held in physical form without any delay to receive the notice of AGM or the logic credentials for the E-voting by email.

In case of any members have any queries or issues regarding remote e-voting may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at https://www.evoting.nsdl.com under help section or write an email to evoting@nsdl.co.in or call at toll free no 1800-222-990 or contact the Company Secretary of the company at cs@narmadaagrobase.com

By order of the Board For, Narmada Agrobase Limited

Date: 08th September, 2023 Place: Ahmedabad

Nidhi Jair **Company Secretary**

પૂજાવેસ્ટર્ન મેટાલિક્સ લિમિટેડ

૨જી. ઓફિસ: પ્લોટ નં. ૧, ફેઝ ૨, જીઆઈડીસી, ડારેડ, જામનગર, ગુજરાત–૩૬૧૦૦૪, (ભારત)

ટેલ. નં.: ૨૮૮–૨૭૩૦૦૮૮, વેબસાઈટ: www.poojametal.com ઈમેઈલ: poojametals@gmail.com

કંપનીની 7મી વાર્ષિક સામાન્ય સભા અને ઈ-વોટિંગની સૂચના આથી સૂચના આપવામાં આવે છે કે કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) અને પરિપત્ર SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 દ્વારા જારી કરાયેલ 28 ડિસેમ્બર, 2022ના

સામાન્ય પરિપત્ર નં. 10/2022ના અનુસંધાનમાં તારીખ 5 જાન્યુઆરી, 2023 ના રોજ સેબી દ્વારા જારી કરવામાં આવે છે (ત્યારબાદ સામૂહિક રીતે "ધ પરિપંત્ર" તરીકે ઓળખવામાં આવે છે), કંપનીઓને સામાન્ય સ્થળે સભ્યોની ભૌતિક હાજરી વિના, વીસી દ્વારા એજીએમ યોજવાની મંજૂરી આપવામાં આવે છે. આથી, પરિપત્રોના પાલનમાં, કંપનીની એજીએમ શનિવાર, 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ બપોરે 12:00 વાગ્યે વીસી દ્વારા યોજવામાં આવી છે. (IST). 7મી એજીએમની કાર્યવાહીનું સ્થળ કંપનીની નોંધાયેલ ઓફિસ એટલે કે પ્લોટ નં. 1 ફેઝ II, જીઆઈડીસી, દરેડ જામનગર-361004, ગુજરાતની નોટિસમાં દર્શાવ્યા મુજબ સામાન્ય વ્યવસાયો અને વિશેષ વ્યવસાયોના વ્યવહાર માટે રહેશે. 7મી એજીએમ. કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) દ્વારા જારી કરાયેલ 28 ડિસેમ્બર, 2022ના સામાન્ય

પરિપત્ર નં. 10/2022 અને તારીખ 5 જાન્યુઆરીના SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4ના પરિપત્ર અનુસાર, SEBI દ્વારા જારી કરાયેલ 2023 (ત્યારબાદ સામૂહિક રીતે "પરિપત્રો" તરીકે ઓળખવામાં આવે છે) વાર્ષિક અહેવાલ 2022-23 સાથે AGM ની સૂચના ફક્ત તે સભ્યોને જ ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા મોકલવામાં આવી છે જેમના ઇમેઇલ સરનામાં કંપની/ડિપોઝિટરીઝમાં નોંધાયેલા છે. સભ્ય નોંધ લે કે નોટિસ અને વાર્ષિક અહેવાલ 2022-23 કંપનીની વેબસાઇટ www.poojametals.com પર, BSE લિમિટેડની વેબસાઇટ www.bseindia.com પર અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) એટલે કે www.evoting.nsdl.com વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.

એમસીએના પરિપત્રોના પ્રકાશમાં, શેરધારકો ડીમેટ સ્વરૂપે અથવા ભૌતિક સ્વરૂપમાં ઇક્વિટી શેર ધરાવે છે અને જેમણે તેમના ઇમેઇલ સરનામાં સંબમિટ કર્યા નથી અને પરિણામે જેમને 7મી એજીએમ અને વાર્ષિક અહેવાલ 2022-23ની નોટિસ આપી શકાઈ નથી, નીચે આપેલ પ્રક્રિયાને અનુસરીને તેઓ અસ્થાયી રૂપે સેવા આપી શકે છે. તેમના ઈ-મેલ સરનામાં રજીસ્ટર કરાવો:

- જો શેર ભૌતિક સ્થિતિમાં રાખવામાં આવ્યા હોય, તો કૃપા કરીને ફોલિયો નંબર શેરધારકનું નામ, શેર પ્રમાણપત્રની સ્કેન કરેલી નકલ (આંગળ અને પાછળ), PAN (પાન કાર્ડની સ્વ-પ્રમાશિત સ્કેન કરેલી નકલ), આધાર (આધાર કાર્ડની સ્વ-પ્રમાશિત સ્ક્રેન કરેલી નકલ) info@poojametal.com પર ઇમેઇલ દ્વારા પ્રદાન કરો.
- 2. જો શેર ડીમેટ મોડમાં રાખવામાં આવ્યા હોય, તો કૃપા કરીને DPID-CLID (16 અંકનો DPID + CLID અથવા 16 અંકનો લાભાર્થી ID), નામ, ક્લાયન્ટ માસ્ટર અથવા ક્રોન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટની કૉપિ, PAN (PAN કાર્ડની સ્વ-પ્રમાણિત સ્ક્રેન કરેલી નકલ) આધાર (આધાર કાર્ડની સ્વ-પ્રમાશિત સ્કેન કરેલી નકલ) info@poojametal.com પર પ્રદાન કરો.
- 3. વપરાશકર્તા ID અને પાસવર્ડ મેળવવા માટે વૈકલ્પિક રીતે સભ્ય ઇ-મેઇલ પર evoting@nsdl.co.in પર કેસ તરીકે પોઇન્ટ (1) અથવા (2) માં ઉલ્લેખિત વિગતોને સાબિત કરીને વિનંતી મોકલી શકે છે.

ઈ-મેલ એડ્રેસની સફળ નોંધણી પછી, શેરધારકને 7મી એજીએમ અને વાર્ષિક રિપોર્ટ 2022-23ની નોટિસની સોક્ટ કોપી અને 7મી માટે ઈ-વોટિંગ સક્ષમ કરવા માટે યુઝર-આઈડી અને પાસવર્ડ સાથે ઈ-વોટિંગ માટેની પ્રક્રિયા મળશે. એજીએમ. કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં, શેરધારક કંપનીને info@poojametal.com પર પત્ર લખી શકે છે. શેરધારકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના ડિપોઝિટરી સહભાગીઓ (ઓ) સાથે તેમના ઈમેલ આઈડીની નોંધણી/અપડેટ કરે કે જેમની સાથે તેઓ તેમના ડીમેટ એકાઉન્ટ્સ જાળવી રાખે છે, જો જરૂરી દસ્તાવેજો સબમિટ કરીને શેર ડીમટીરિયલાઈઝ્ડ મોડમાં રાખવામાં આવ્યા હોય.

શનિવાર, સપ્ટેમ્બર 23, 2023 ("કટ-ઓફ તારીખ") ના રોજ જે સભ્યોના નામ સભ્યોના રજિસ્ટરમાં અથવા ડિપોઝિટરીઝ દ્વારા જાળવવામાં આવેલા લાભદાયી માલિકોના રજિસ્ટરમાં નોંધાયેલા છે, તેઓ ફક્ત દૂરસ્થ ઇન્ની સુવિધા મેળવવા માટે હકદાર હશે. વાર્ષિક સામાન્ય સભામાં મતદાન તેમજ ઈ-વોટિંગ.

કંપની અધિનિયમ, 2013 ની ક્લમ 108 ની જોગવાઈઓને અનુસરીને તે હેઠળ બનાવેલા નિયમો (સુધાર્યા પ્રમાણે) અને સેબી (LODR) રેગ્યુલેશન્સ, 2015 (સુધારેલા મુજબ) ના નિયમન 44 અને ઉપરોક્ત એમસીએ પરિપત્રો સાથે વાંચવામાં આવે છે, કંપની રિમોટની સુવિધા પૂરી પાડે છે. ઇ-વોર્ટિંગ અને એજીએમની તારીખે ઇ-વોટિંગ તેના સભ્યોને એજીએમમાં વ્યવહાર કરવાના વ્યવસાયના સંદર્ભમાં. આ હેતુ માટે, કંપનીએ ઈલેક્ટ્રોનિક માધ્યમથી મતદાનની સવિધા માટે NSDL સાથે કરાર કર્યો છે.

રિમોટ ઈ-વોટિંગ બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023 ના રોજ સવારે 9:00 વાગ્યે શરૂ થશે. અને શુક્રવાર, સપ્ટેમ્બર 29, 2023 ના રોજ સાંજે 5ઃ00 વાગ્યે સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન, કટ-ઓફ તારીખે શેર ધરાવનાર કંપનીના સભ્યો ઈલેક્ટ્રોનિક રીતે તેમનો મત આપી શકે છે (રિમોટ ઈ-વોટિંગ). સભ્યો નોંધ લે કે a) NSDL દ્વારા મતદાન માટેની ઉપરોક્ત તારીખ અને સમય પછી રિમોટ ઈ-વોટિંગ મોક્યુલને અક્ષમ કરવામાં આવશે અને એક વખત સભ્ય દ્વારા ઠરાવ પર મત આપવામાં આવે, પછી સભ્યને તેને બદલવાની મંજૂરી આપવામાં આવશે નહી; b) ઈ-વોટિંગની સુવિધા 7મી એજીએમમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે; અને c) જે સભ્યોએ 7મી એજીએમ પહેલાં રિમોટ ઈ-વોટિંગ દ્વારા તેમનો મત આપ્યો છે તેઓ પશ 7મી એજીએમમાં હાજરી આપી શકે છે પરંતુ તેઓ ફરીથી તેમનો મત આપવા માટે હકદ્યર રહેશે નહીં. 7મી વાર્ષિક સામાન્ય સભાની સૂચનામાં રિમોટ ઈ-વોટિંગ/ ઈ-વોટિંગ માટેની વિગતવાર પ્રક્રિયા પૂરી પાડવામાં આવી છે.

કોઈપણ વ્યક્તિ, જે કેંપનીના શેર મેળવે છે અને એજીએમની નોટિસ મોકલ્યા પછી અને કટ-ઓફ તારીખ એટલે કે 23 સપ્ટેમ્બર, 2023ના રોજ શનિવારના રોજ શેર રાખ્યા પછી કંપનીના સભ્ય બને છે. તેમને એજીએમની નોટિસનો સંદર્ભ લેવા વિનંતી કરવામાં આવે છે. મત આપવા માટે USER ID અને પાસવર્ડ મેળવવા માટેની પ્રક્રિયા અપનાવવામાં આવશે. ઈ-વોટિંગ માટે કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં, તમે શેરધારકો માટે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) અને www.evoting.nsdl.com ના ડાઉનલોડ વિભાગ પર ઉપલબ્ધ શેરધારક્રો માટે ઈ-વોટિંગ વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લઈ શકો છો અથવા ટોલ ફ્રી નંબર : 1800-222-990 પર કૉલ કરી શકો છો. અથવા evoting@nsdl.co.in પર વિનંતી મોકલો. સભ્યો કંપનીની નોંધાયેલ ઓફ્સિમાં કંપનીના કંપની સેક્રેટરી શ્રી તેજુસ રમેશચંદ્ર પીઠાડિયાનો પણ સંપર્ક કરી શકે છે અથવા કોઈપણ વધુ સ્પષ્ટતા માટે www.poojametals.com પર ઈ-મેલ લખી શકે છે.

સભ્યો VC/OAVM સુવિધા દ્વારા વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપી શકે છે અને તેમાં ભાગ લઈ શકે છે. VC/OAVM દ્વારા વાર્ષિક સામાન્ય સભામાં જોડાવા માટેની સૂચનાઓ વાર્ષિક સામાન્ય સભાની સૂચનામાં આપવામાં આવી છે. જો શેરધારકો/સભ્યોને એજીએમમાં ભાગ લેવા અંગે કોઈ પ્રશ્નો અથવા સમસ્યાઓ હોય, તો તમે evoting@nsdl.co.in પર ઈમેલ લખી શકો છો અથવા અમને કૉલ કરોઃ ટેલિફોનઃ 1800-222-990. કંપની અધિનિયમ, 2013 ની કલમ 103 હેઠળ કોરમની ગણતરીના હેતુઓ માટે VC/OAVM દ્વારા મીટિંગમાં હાજર રહેલા સભ્યોની ગણતરી કરવામાં આવશે.

પૂજાવેસ્ટર્ન મેટાલિક લિમિટેડ વતી, એસડી/-

સુનીલ દેવરામ પંચમતીયા સ્થળઃ જામનગર ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તારીખઃ ૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ ડીન: 02080742

PALM JEWELS LIMITED

NOTICE OF 18[™] ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 18° Annual General Meeting (AGM) of the Members of **Palm Jewe** Limited is scheduled to be held on **Saturday, 30° September, 2023 at 11:00 AM** at the registere Limited is scheduled to be frieto in Saturday, 30 September, 2023 at 11:00 AM at the registered office of the Company at C/205, D/205, D2" Floor, Super Mall Besides Lal Bungalow, C.G. Road, Ahmedabad-380009, Gujarat, India to transact the business as set out in the Notice of the 18" AGM, which is being circulated for convening the AGM. The Company has already dispatched the Annual Report for the Financial Year 2022-23 along with the Notice convening 18" AGM through electronic mode to the Shareholders whose email address are registered with the Company of the Properties of the Ministry of the Ministr Company and / or Depositories in accordance with the Circulars issued by the Ministry Corporate Affairs and Securities and Exchange Board of India. The Annual Report along with th Notice of 18" AGM also available on the website of the company at www.palmjewelsltd.comand of the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com.

As Per Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Manage As Per Section 10s of the Companies Act, 2013 read with Kulue 20 of the Companies (Management and Administration) Rules, 2014, Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and the Secretarial Standards on General Meeting ("SS-2") issued by the Institute of Company Secretary of India, the Company is providing facility to all its Members to cast their vote on all resolutions to be set forth in the Notice of the AGM by electronic means (e-voting) by using electronic voting system provided by the NSDL. The voting rights of the members shall be in the proportion to the equity share held by them in the paid up equity share of the Company as on Friday, September 22, 2023 (the "cut-off date"). The details are required presented for the provision of the Companies act 2013 and pulse made the prevision of the Companies act 2013 and pulse made the prevision of the Companies act 2013 and pulse made the provision of the Companies act 2013 and pulse made the provision of the Companies act 2013 and pulse made the provision of the Companies act 2013 and pulse made the provision of the Companies act 2013 and pulse made the provision of the Companies and pulse made the provision of the Companies act 2013 and pulse made the provision of the Companies and pulse made the pulse and resuant to the provision of the Companies Act. 2013 and rules made thereunder are given below The Book closure period shall commence on 24th September, 2023 and ends on 30th September

- 2023 (both days inclusive); The remote e-voting period will commence at 09:00 a.m. on Wednesday, September 27, 202 and will end at 05:00 p.m. on Friday, September 29, 2023.
- Cut-off date for determining rights of entitlement of e-voting is Friday, September 22, 2023; The members will not be allowed to vote through remote e-voting beyond the period as specific
- Shareholder acquiring the share of the company and becomes the members of the company
- after sending of the Notice and holding Shares as of the cut-off date may follow steps mention the Notice of AGM to exercise their voting rights;
- The Members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend/ participate in the AGM but shall not be entitled to cast their vote again.

 The Board has appointed M/s. Neelam Somani & Associates, Practising Company Secretary to
- act as the Scrutinizer to scrutinize the e-voting procedure, who shall submit the results of voting

In case of any queries/grievances pertaining to remote e-voting you may refer to the Frequentl Asked Questions ('FAQs') for Shareholders and e-voting user manual for Shareholder available at www.evoting.nsdl.com.under.help.section.or.contact.at.022-23058542/43.

FOR, PALM JEWELS LIMITED sd/- ROHIT SHAH Place : Ahmedabad Managing Director (DIN: 00543440

Date: 07/09/2023

શીશ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ

પહેલો માળ, ૧૧, ૧૨ સૂર્યપુર મિલ કમ્પાઉન્ડ, વરાછા રોડ, સુરત–૩૯૫ ૦૦૬. ગુજરાત, ભારત ટેલિફોન : +લ્૧ ૨૯૧ રેપપ ૦૫૭૯, વેબસાઈટ: www.shishindustries.com; **ย-มิย์ต**: compliance@shishindustries.com

કંપનીની સામાન્ય મીટિંગની સૂચના, બુક બંધ, નક્કી કરેલી તારીખ અને ઇ-મતદાનની સૂચના

ખાથી સૂચના આપવામાં આવે છે કે કોઈ એક સ્થળે સભ્યોની શારીરિક હાજરી વિના વિડિયો સંગઠન (VC) અથવા અન્ય ઓડિયો વિડિયો માધ્યમ (OAVM) દ્વારા સામાન્ય સભા યોજવા માટે કોર્પોરેટ બાબતોનું મંત્રાલય દ્વારા તારીખ ૮ મી એપ્રિલ ૨૦૨૦ ના રોજ જારી કરાયેલા સામાન્ય પરિપત્ર નં. ૧૪/૨૦૨૦, તારીખ ૧૩ મી એપ્રિલ ૨૦૨૦ ના રોજ જારી કરાયેલા સામાન્ય પરિપત્ર નં. ૧૭/૨૦૨૦ અને તારીખ ૨૮ મી ડિસેમ્બર. ૨૦૨૨ ના રોજ જારી કરાયેલા સામાન્ય પરિપત્ર નં. ૧૧/૨૦૨૨ પ્રમાણે શીશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (કંપની) ના સભ્યોની સામાન્ય સભા (ઈજીએમ) શનિવારે તારીખ ૩0 મી સપ્ટેમ્બર, ૨0૨૩ એ સવારનાં ૧૧:૦૦ વાગ્યે ઈજીએમની સૂચનામાં જશાવ્યા મુજબનાં ખાસ અને સામાન્ય વ્યવસાયો નો

યવહાર મંજૂર કરવા માટે VC / OAVM દ્વારા યોજવામાં આવશે. ઉપર્ જશાવેલા ક્રોપોરેટ બાબતોનું મુંત્રાલય ના પરિપત્રો પ્રમાણે અને સેબી દ્વારા તારીખ ૧૩ મી મે, ૨૦૨૨ ના રોજ જારી કરાયેલ પરિપત્ર નં. સેબી/એચઓ/સીએફડી/સીએમડી૨/ સીઆઈઆર/પી/ ૨૦૨૨/૬૨, ઈજીએમની સૂચના ફક્ત તે જ સભ્યોને ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા મોકલવામાં આવી રહી છે, જેમના ઇમેઇલ સરનામાંઓ કંપની / ડિપોઝિટરીઝમાં શુક્રવાર તારીખ ૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ નોંધાયેલા છે. સભ્યોને નોંધ લેવા વિનંતિ છે કે ઈજીએમની સૂચના કંપનીની વેબસાઇટ www.shishindustries.com પર, બીએસઈ લિમિટેડની વેબસાઇટ www.bseindia.com પર અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી િલમિટેડ (એનએસડીએલ) ની વેબસાઇટ www.evoting.nsdl.com પર પણ મુકવામાં

ઉપર જ્ણાવેલા કોર્પોરેટ બાબતોનું મંત્રાલય નાં પરિપત્રો પ્રમાણે એ બધા સભ્યો કે જે ડીમેટ ત્વરૂપમાં અથવા ભૌતિક સ્વરૂપમાં કંપનીના ઇક્વિટી શેર ધરાવે છે અને પોતાનાં ઇ-મેઇલ સરનામાં નથી નોંધાવ્યા જેના લીધે ઈજીએમની સૂચના નથી મોકલી શકાઇ એ સ્ભ્યો ત્રસ્થાયીરૂપે તેમના ઇ-મેઇલ સરનામા કંપની સાથે આ પ્રમાણે નોંધાવી શકે છે, (એ) જો ભૌતિક સ્વરૂપમાં શેર ધરાવો છો તો શેરધારકનું નામ, શેર પ્રમાણપત્રની સ્કેન કરેલી નકલ (આગળ અને પાછળ), પાન (પાનકાર્ડની સ્વ-પ્રમાશિત સ્કેન કરેલી નકલ), આધાર આધારકાર્ડની સ્વ-પ્રમાશિત સ્ક્રેન કરેલી નકલ) compliance@shishindustries.com પર ઇ-મેઇલ કરી ને, (બી) જો ડીમેટ સ્વરૂપમાં ધરાવો છો તો નામ, DPID-CLID (16 અંકનો DPID + CLID અથવા 16 અંકોના લાભાર્થી ID), ક્લાયંટ માસ્ટર અથવા કન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટની નકલ, પાન (પાનકાર્ડની સ્વ-પ્રમાશિત સ્ક્રેન કરેલી નકલ), નાધાર (આધારકાર્ડની સ્વ-પ્રમાણિત સ્કેન કરેલી નકર્લ ompliance@shishindustries.com પર્ઇન્મેઇલ કરી ને, ૩) અથવા તો સભ્યો પોઈન્ટ (એ) અથવા (બી) માં જણાવેલ વિગતો ઇ-મેઇલ દ્વારા evoting@nsdl.co.in પર

મોકલીને યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવા માટે વિનંતી કરી શકે છે. ડે-મેઇલ સ^રનામાંની સફળ નોંધણી પછી, સભ્ય ને ઈજીએમ સંદર્ભે ઈજીએમની સૂચના ની ઇલેક્ટ્રોનિક નકલો, યુઝર આઇડી અને પાસવર્ડ અને ઇલેક્ટ્રોનિક મતદાન માટેની પ્રક્રિયા તેમને ઇલેક્ટ્રોનિક મતદાન માટે સક્ષમ બનાવવા માટે મોકલવામાં આવશે. કોઈપણ પ્રશ્નોના સ્સામાં, સભ્યો compliance@shishindustries.com પર કંપનીને વિનંતી કરી શકે : શેરધારકોને વિનંતી છે કે તેઓ તેમની સંપૂર્ણ બેંક વિગતો અને ઇમેઇલ આઈડી નોંધણી / અપડેટ કરવા માટે તેમના ડિપોઝિટરી સહભાગીઓ, જેમની સાથે તેઓ ડિમટીરીયલાઇઝડ સ્વરૂપમાં હિસ્સો ધરાવે છે, તેને જરૂરી દસ્તાવેજો આપી ને તેમના ડિમેટ ખાતાની જાળવણી

કંપનીમાં કોઈપણ શેરહોલ્ડરો ભૌતિક સ્વરૂપમાં ઇક્વિટી શેર ન ધરાવતાં હોવાને કારણે કંપનીના સભ્યોના રજિસ્ટર અને શેર ટ્રાન્સફર પુસ્તકો બંધ રહેશે નહીં. એ બધા સભ્યો કે જેમના નામ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ (નક્કી કરેલી તારીખ) ના રોજ કંપનીના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ દ્વારા જાળવવામાં આવેલા સભ્યોના રજિસ્ટરમાં અને ડિપોઝિટરીઓ પાસેથી પ્રાપ્ત થયેલા લાભદાયી માલિકો દેખાય છે ફક્ત એ જ સભ્યો દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદ્યન અને સામાન્ય સભા નાં દિવસે ઇલેક્ટ્રોનિક મતદ્યન ની સુવિધાનો લાભ મેળવવાના

કંપનીઓનો ધારો, ૨૦૧૩ ("ધારો") ની કલમો ૧૦૮ ની જોગવાઈઓ અને અન્ય લાગુ ક્ષેગવાઈઓને અનુસરીને અને કંપનીઓ (સંચાલન અને વહીવટ) નિયમો, ૨૦૧૪ (સમય⁻ સમય પર સુધારેલા મુજબ) (''નિયમો) ના નિયમો ૨૦ ને સાથે વાંચીને અને સેબી (સૂચિબદ્ધ જવાબદ્યરી અને જાહેરાત આવશ્યકતાઓ) નિયમનો, ૨૦૧૫ (સેબી સૂચિઓ નિયમો) ના નિયમન ૪૪ અને અન્ય લાગુ કાયદા અને નિયમો ધ્યાનમાં રાખીને, કંપની તેના સભ્યોને ઇજીએમમાં વ્યવસાયોને વ્યવહાર કરવા માટે દરસ્થ ઇલેક્ટોનિક મતદાન અને સામાન્ય સભા નાં દિવસે ઇલેક્ટ્રોનિક મતદાન ની સવિધા પ્રદાન કરી રહી છે. કંપનીએ તમામ સભ્યોને ઇલેક્ટ્રોનિક મતદાન ની સુવિધા આપવા માટે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ

"એનએસડીએલ") સાથે કરાર કર્યો છે. સભ્યો નોંધી શકે છે કે દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન બુધવાર, ૨૭ સપ્ટેમ્બર, ૨0૨૩, નાં રોજ સવારનાં ૦૯:૦૦ વાગ્યા થી શરૂ થશે અને શનિવાર, ૨૯ સપ્ટેમ્બર, ૨0૨૩ નાં રોજસાંજનાં ૦૫:૦૦ વાગતાં (બંને દિવસો સહિત) પુર્શ થશે. આ સમયગાળા દરમિયાન, એ બધા સભ્યો કે જેમના નામ નક્કી કરેલી તારીખ ના રોજ કંપનીના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ દ્વારા જાળવવામાં આવેલા સભ્યોના રજિસ્ટરમાં અને ડિપોઝિટરીઓ પાસેથી પ્રાપ્ત થયેલા લાભદાયી માલિકો દેખાય છે ફક્ત એ જ સભ્યો દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાનની સુવિધાનો લાભ મેળવવાના હકદાર રહેશે અને આવા સભ્યો ઇલેક્ટ્રોનિક રીતે પોતાનો મતે આપી શકશે. ત્યારબાદ એનએસડીએલ દ્વારા દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન કરવા માટે ઇ-મતદાન મો.ક્યુલ અક્ષમ કરવામાં આવશે. એકવાર સભ્ય દ્વારા ઠરાવ પર મત આપ્યા પછી, તે / તેણીને પછીથી બદલવાની અથવા ફરીથી મત આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સામાન્ય સભા નાં દિવસે ઇલેક્ટ્રોનિક મતદાન ની સુવિધા આપવામાં આવશે. જે સભ્યોએ ઇજીએમ પહેલાં દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન દ્વારા પોતાનો મત આપ્યો છે તે પણ ઇજીએમ માં હાજર રહી શકે છે પરંતુ તેઓ ફરીથી મતદાન કરવાનો હકદાર રહેશે નહી. દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન / ઇલેક્ટ્રોનિક મતદાન માટેની વિગતવાર પ્રક્રિયા ઇજીએમ ની સૂચનામાં આપવામાં આવેલી છે.

કોઈપણ વ્યક્તિ, જે કંપનીના શેરો ઇજીએમની સૂચના મોકલ્યા પછી મેળવે છે અને નક્કી કરેલી તારીખ પર ધરાવે છે, તે evoting@nsdl.co.in અથવા ompliance@shishindustries.com પર વિનંતી મોકલીને યુઝર આઇડી અને પાસવર્ડ અને ઇલેક્ટ્રોનિક મતદાન માટેની પ્રક્રિયા મેળવી શકશે. જો કે, જો તમે દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન માટે પહેલેથી જ એનએસડીએલ સાથે નોંધાયેલ છે, તો પછી તમે તમારા મત આપવા માટે તમારી હાલની યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકો છો. જો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા છો, તો તમે www.evoting.nsdl.com પર ઉપલબ્ધ "પાસવર્ડ ભૂલી ગયા છો" વિકલ્પનો ઉપયોગ કરીને તમારો પાસવર્ડે ફરીથી સેટ કરી શકો છો.

દૂરસ્થ ઇલેક્ટ્રોનિક માધ્યમને લગતાં કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં, તમે સભ્યો દ્વારા વારવાર પૂછાતા પ્રશ્નો (FAQs) નો સંદર્ભ લો અને www.evoting.nsdl.com ના ડાઉનલોડ વિભાગ પર ઉપલબ્ધ સભ્યો માટે દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન વપરાશકર્તા માર્ગદર્શિકા અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૦૨૦ ૯૯૦ અને ૧૮૦૦ ૨૨ ૪૪ ૩૦ પર ફોન કરી શકો છો અથવા evoting@nsdl.co.in પર વિનંતી મોકલી શકો છો. સભ્યો કંપનીની રજિસ્ટર્ડ ઓફ્રિસ પર શ્રીમતી વિભા ખંડેલવાલ, કંપની સચિવ અને પાલન અધિકારી, નો સંપર્ક પણ કરી શકે છે અથવા compliance@shishindustries.com પર ઇ-મેઇલ લખી શકે છે અથવા વધુ સ્પષ્ટતા માટે +૯૧ ૨૬૧ ૨૫૫ ૦૫૮ ૭ફોન કરી શકે છે.

સભ્યો ફક્ત VC / OAVM સુવિધા દ્વારા સામાન્ય સભામાં ભાગ લઈ શકે છે. સામાન્ય સભામાં જોડાવા માટેની સૂચના સામાન્ય સભાની સૂચનામાં આપવામાં આવી છે. જો સભ્યો ને ઇજીએમમાં ભાગ લેવા સંબંધિત કોઈ પ્રશ્નો અથવા સમસ્યાઓ છે, તો તમે evoting@nsdl.co.in પર ઇમેઇલ લખી શકો છો અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૦૨૦ ૯૯૦ અને ૧૮૦૦ ૨૨ ૪૪ ૩૦ પર ફ્ષેન કરી શકો છો. VC / OAVM દ્વારા ઇજીએમમાં ભાગ લેનારા સભ્યોની ગણતરી કંપનીઓનો ધારો, ૨૦૧૩ ની કલમ ૧૦૩ હેઠળ કોરમની બોર્ડના આદેશ દ્વારા શીશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગશતરીના હેત્ માટે કરવામાં આવશે.

સતીશકુમાર માણીયા, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નિયામક ઓળખ નંબર: ૦૨૫૨૯૧૯૧ સ્થળઃ સુરત તારીખ: ૦૮/૦૯/૨૦૨૩

SHISH INDUSTRIES LTD

સી.આઇ.એન.: એલરપર૦િંજીજેર૦૧૭પીએલસી૦૯૭૨૭૩ **રજીસ્ટર્ડ એફિસ**: ટીપી નંબર ૪, આરએસ નં. ૧૧ પૈકી, ૧૨–૧૩ બી પૈકી, પ્લોટ સી,

यूनियन बैंक 🕠 Union Bank

ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ

Director of Govt. Printing & Stationery Bolck no.8, 4th floor, Udhyog Bhavan, Gandhinagar Ph.23259356

GeM (Custom) Bid are invited for below Machines & Paper item No. Bid Number Particular Electromagnetic Knife GEM/2023/B/3811654 **Grinding Machine** GEM/2023/B/3738043 Heavy Duty Single Head Wire Stitching Machine Hot Foil Stamping & GEM/2023/B/3811465 Embossing Machine Programmatic Heavy Duty GEM/2023/B/3749513 Paper Cutting Machine GEM/2023/B/3906368 Folding Box Board (white Back)

> Government of India Public Enterprises Selection Board invites applications for the post of

Bides are available on https://gem.gov.in

Chairman & Managing Director

Balmer Lawrie & Co. Ltd. Last date of submission of application by the applicant is

03rd October, 2023

Last date of forwarding of applications by the Nodal officers to PESB is

> 12th October, 2023 For details login to website http://www.pesb.gov.in

> > SHISH INDUSTRIES LTD

SHISH INDUSTRIES LIMITED

CIN: L25209GJ2017PLC097273

Registered Office: TP No.4, RS No.11 Paiki, 12-13 B, Paiki Plot C 1st Floor of 11, 12 Suryapur Mil

Compound, Varachha Road, Surat-995006, Gujarat, India. Telephone: +91 261 255 0587 Website: www.shishindustries.com; Email: compliance@shishindustries.com NOTICE OF THE EXTRA ORDINARY GENERAL MEETING OF THE COMPANY, CUT DATE AND E-VOTING

NOTICE is hereby given that, in accordance the General Circular No. 14/2020 dated April 8, 2020, the General Circular No. 17/2020 dated April 13, 2020 and the General Circular No. 11/2022 dated December 28, 2022 (hereinafter collectively referred to as "MCA Circulars") issued by Ministry of Corporate Affairs ("MCA") for holding of Extra Ordinary General Meeting through VC or OAVM without the physical presence of Members at a common venue, the Extra Ordinary General Meeting (EOGM) of the Members of Shish Industries Limited will be held on Saturday, September 30, 2023 at 11.00 a.m. IST through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the Special and Ordinary Businesses as set out in the notice of EOGM. In accordance with the above mentioned MCA Circulars and SEBI Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022, the Notice of EOGM is being sent through electronic mode only to those Members whose email addresses are registered with the Company / Depositories as on Friday, September 1, 2023. Member may note that Notice has been uploaded on the website of the Company at www.shishindustries.com, website of BSE Limited at www.bseindia.com and website of National Securities Depository Limited (NSDL) i.e. www.evoting.nsdl.com.

In light of the MCA Circulars, the shareholders whether holding equity shares in demat form or physical form and who have not submitted their email addresses and in consequence to whom the notice EOGM could not be serviced, may temporarily get their e-mail addresses registered with the Company where (1) in case shares are held in physical mode, please provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (selfattested scanned copy of Aadhar Card) by email to compliance@shishindustries.com; (2) in case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) to compliance@shishindustries.com; or (3) alternatively member may send an e-mail request to evoting@nsdl.co.in for obtaining User ID and Password by proving the details mentioned in Point (a) or (b) as the case may be.

Post successful registration of the e-mail address, the shareholder would get soft copies of notice of EOGM and the procedure for e-voting along with the user-id and the password to enable them for e-voting in respect of EOGM. In case of any queries, shareholder may write to the Company at compliance@shishindustries.com. Shareholders are requested to register/ update their complete bank details and Email Ids with their Depository Participant(s) with whom they maintain their demat accounts if shares are held in dematerialized mode by submitting the requisite documents.

There being no physical shareholders in the Company, the Register of members and share transfer books of the Company will not be closed. Members whose names are recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the Cut-off date i.e. Saturday, September 23, 2023, shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting system on the date of the EOGM.

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rules made thereunder (as amended) and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015 (as amended) and above mentioned MCA Circulars, the Company is providing facility of remote e-voting and e-voting on the date of the EOGM to its Members in respect of the businesses to be transacted at the EOGM. For this purpose, the Company has entered into an agreement with NSDL for facilitating voting through electronic means.

The remote e-voting will commence on 9:00 a.m. on Wednesday. September 27, 2023 and will end on 5:00 P.M. on Friday, September 29, 2023. During this period, the members of the Company holding shares as on Cut-off date may cast their vote electronically (Remote E-Voting). Members may note that a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) the facility of evoting shall be made available at the EOGM; and c) the members who have cast their vote by remote e-voting prior to the EOGM may also attend the EOGM but shall not be entitled to cast their vote again. Detailed procedure for remote e-voting/ e-voting is provided in the Notice of the Extra Ordinary General Meeting.

Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of EOGM and holding shares as on the cut-off date i.e. Saturday, September 23, 2023, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in or compliance@shishindustries.com. However, if you are already registered with NSDL for remote e-voting then you can use your existing user ID and password for casting your vote. If you forgot your password, you can reset your password by using "Forgot Password" option available on www.evoting.nsdl.com.

In case of any queries for e-voting, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800 1020 990 and 1800 22 44 30 or send a request at evoting@nsdl.co.in. Members may also contact Mrs. Vibha Khandelwal, Company Secretary and Compliance officer, at the registered office of the Company or at Email id: compliance@shishindustries.com or on +91 261 255 0587 for any further clarification.

Members can attend and participate in the Extra Ordinary General Meeting through VC/OAVM facility only. The instructions for joining the Extra Ordinary General Meeting are provided in the Notice of the Extra Ordinary General Meeting. In case the shareholders/members have any queries or issues regarding participation in the EOGM, you can write an email to evoting@nsdl.co.in or Call at: - Tel: 1800 1020 990 and 1800 22 44 30. Members attending the meeting through VC/OAVM shall be counted for the purposes of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

For, Shish Industries Limited --sd--

Place: Surat Date: September 8, 2023



MALABAR CEMENTS LIMITED
(A Government of Kerala Undertaking)
An ISO 9001:2015, 14001:2015 Company, Walayar Post, Palakkad-678624-Kerala,
Email: materials@malabarcements.com/ bulkmcl@malabarcements.com/

Visit www.etenders.kerala.gov.in for Online Submission of Bids for Supply of Rock Breaker. Supply of Centralized Energy Monitoring. Supply of OTR Tyres Tubeless 1800 x 25. Shiring of three mini buses with minimum 32 No. Of seats for Malabar Cements Limited. Service contract for drilling of 4.5 inch DIA blasting holes at MCL mines.

TENDER NOTICE

Renewal of points and crossing (No.102 and 103) with PSC layout at MCL Railway siding at Walayar. Sd/- MANAGING DIRECTOR



INF1268/23-24

Gujarat Pollution Control Board

Paryavaran Bhavan, Sector 10 A, Gandhinagar 382 010 Tel: 079-23232152 Fax: 079-23222784 www.gpcb.gov.in

Public Notice

It is hereby to inform that as per Ministry of environment, Forest & Climate Change, Government of India, New Delhi vide its Notification no. S.O.1533 (E) dated September 14, 2006; Public Hearing has been fixed for M/s Shri Ramesh Kalabhai Barad (Lor Black Trap Block · B Lease Area: 2.83.29 Ha) for Proposed Rate of Mining -1,25,000 MTPA, at Survey No. 90/4 Paiki 2, Pvt. land, Village: Lor, Taluka: Jafrabad, Dist. Amreli (Total Cluster Area: 6.55.29 Ha), Covered under project Category "B" as mentioned in their request application.

All local affected persons of the project are requested to remain present in the public hearing or send their response in writing to Member Secretary, Gujarat Pollution Control Board before the hearing date.

Other concerned persons having a plausible stake in environment aspects of the project or activity can submit their responses to Member Secretary, Gujarat Pollution Control Board in writing before the hearing date.

It may be noted that draft Environmental Impact Assessment Report and Executive Summary of the Environment Impact Assessment Report of the project has been sent to the following authorities or offices to make it available for inspection to the public during normal office hours till the Public Hearing is over.

1. District Collector Office, **Amreli**.

- District Development Office, Amreli.
- District Industry Centre, Amreli.
- Taluka Development Office, Ta.: Jafrabad, Dist.Amreli 5. Regional Officer, Integrated Regional Office, Ministry Of environment Forests and Climate Change, Room No.407, Aranya Bhavan, Near CH-3 Circle, Sector: 10A, Gandhinagar, Gujarat-382010.
- 6. Regional Office, Gujarat Pollution Control Board, Bhavnagar. Swastik Complex, First Floor, Plot No.1616/ 1617, Near Vir Mokhdaji Circle, Ghogha Road, Bhavnagar-364001.

The District Magistrate/District Collector/Deputy Commissioner or his/her representative not below the rank of an Additional District Magistrate or any other District Level Officer authorized by him/her in this behalf shall supervise and preside over the entire public hearing

(Note: If a project or activity is confined to the territorial jurisdiction of one sub-division, the District Magistrate/ District Collector/ Deputy Commissioner may alternatively authorize any officer not below the rank of Sub-Divisional Magistrate to supervise and preside over the entire public hearing process).

The Public Hearing is scheduled to be held on 10/10/2023 at 11:00 hrs, Venue; At Open Plot, Near to Shitlamata Temple, Near Shri Kanubhai Baraiya's House, Lor to Pichhadi Road, Vill. Pichhadi, Ta.

Jafrabad, Dist. Amreli. Considering the present situation of pandemic of Covid-19 all concerned are hereby informed to follow Government guidelines regarding Covid-19 pandemic.

Place: Gandhinagar Date: 04/09/2023

D. M. Thaker Member Secretary



Gujarat Pollution Control Board Paryavaran Bhavan, Sector 10 A, Gandhinagar 382 010
Tel 079-23232152 Fax 079-23222784, www.gpcb.gujarat.gov.in **Public Notice**

It is hereby to inform that as per Ministry of Environment, Forest & Climat Change, Government of India, New Delhi vide its Notification no. S.O. 1533 (E) dated September 14, 2006; Public Hearing has been fixed for M/s Hindalco Industries Limited for Proposed Manufacturing of "Secondary Metallurgical Processing Industries (Ferrous & Nonferrous)" – (1) Copper Tube – 50,000 MT/Annum and (2) Copper Rod, Copper Alloy Rod, Copper Wires & Copper Alloy Wires - 24,000 MT/Annum - (Total Capacity – 74,000 MT/Annum), at Plot No. 187/P & 187/P/1/B/2, 187/P & 187/P/1/B/3, 187/P & 187/P/1/B/4, 187/P & 187/P/1/B/5 & 187/P & 187/P/1/B/6, Waghodia GIDC, Ta. Waghodia, Dist: Vadodara, covered

All local affected persons of the project are requested to remain present in the public hearing or send their response in writing to Member Secretary, Gujarat

project or activity can submit their responses to Member Secretary, Gujarat

Pollution Control Board in writing before the hearing date.

It may be noted that draft Environment Impact Assessment Report and Executive Summary of the Environment Impact Assessment Report of the project has been sent to the following authorities or offices to make it available for inspection to the public during normal office hours, till the Public Hearing is

- 1. District Collector Office, Vadodara.
- . District Development Office, Vadodara.
- District Industry Centre, Vadodara. 4. Taluka Development Office, Ta. Waghodia, Dist. Vadodara.

Regional Officer, Integrated Regional Office, Ministry of Environment, Forests and Climate Change, Room No. 407, Aranya Bhawan, Near CH-3

Regional Office, Gujarat Pollution Control Board, Vadodara GERI Compound, Race Course Road, Vadodara 390 007.

representative not below the rank of an Additional District Magistrate or any other District Level Officer authorized by him/her in this behalf shall supervise and preside over the entire public hearing process.

(Note:- If a project or activity is confined to the territorial jurisdiction of one sub-division, the District Magistrate/District Collector/Deputy Commissioner may alternatively authorize any officer not below the rank of Sub-Divisional Magistrate to supervise and preside over the entire public hearing process).

187/P/1/B/4, 187/P & 187/P/1/B/5 & 187/P & 187/P/1/B/6, Waghodia GIDC, Ta. Waghodia, Dist: Vadodara at M/s Hindalco Industries Limited. Considering the present situation of pandemic of Covid-19 all concerned are hereby informed to follow Government guidelines regarding Covid-19 pandemic Place: Gandhinagai

Member Secretary



acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in

Motilal Oswal Home Finance Limited

MOTILAL OSWAL HOME LOANS

Regd. Office: Motifal Oswal Tower, Rahimtullah Sayani Road, Opp. Parel ST Depot, Prabhadevi, Mumbai - 400 025, Tel: (022) 47189999 **Website**: www.motilaloswalhf.com, **Email**: hfquery@motilaloswal.com

Whereas the undersigned being the Authorised Officer of the Motilal Oswal Home Finance Limited (Formally known as Aspire Home Finance Corporation Ltd). under the Securitisation and Reconstruction of Financial Assets & in

compliance of Rule 8(1) of Enforcement of Security Interest Act, 2002, and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued demand notice/s on the date mentioned against each account calling upon the respective borrower/s to repay the amount as mentioned against each account within 60 days from the date of notice(s)/date of receipt of the said notice/s.

The borrower's in particular and the public in general is hereby cautioned not to deal with the property/ies and any dealing with the property/ies will be subject to the charge of **Motilal Oswal Home Finance Limited**, for the amount and interest thereon as per loan agreement. The borrowers attention is invited to provisions of Sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. Sr Loan Agreement No. / Demand Date of

No.	Name of the Borrower/ Co Borrower/Guarantor	Notice Date & Amount	possession Taken	Property/ies Mortgaged
1	LXSUR00217-180055006 Rohit Nitinchandra Devle & Shila Nitin Devale	13-12-2022 for Rs. 1323768/-	03-09-2023	Flat No A/310, 4th Floor, Mark Point, R.S.No 128/1, Block No 204, T.P. Scheme No 69, F.P.173, Dindoli Kar Adva Road, Dindoli, Surat 394210 Surat Gujarat
2	LXSUR00314-150003293 Ranjeetkumar Ashok Patel & Ashok Shreeramchand Patel	09-11-2022 for Rs. 1132861/-	03-09-2023	Plot No. 82, Haridham Co. Op. Hou. Soc. Ltd, Palsana, Kadodara, Surat, B/H.Noorie Media Ltd, Chorasi, Surat, Gujarat 394327

Date :09.09.2023



All India Institute of Medical Sciences, Nagpur (Maharashtra) Plot No. 2, Sector - 20, MIHAN, Nagpur, Pin: 441108,

https://aiimsnagpur.edu.in Dated: 09/09/2023

RECRUITMENT TO THE POSTS OF SENIOR RESIDENT

Closing Date: 12/09/2023

Applications are invited by the Executive Director, AIIMS Nagpur for the posts of senior resident under the

No. Name of the Department								
140.		UR	OBC	SC	ST	EWS	Total	
1	Anaesthesiology	1	1	-	1	-	3	
2	Anatomy	-	-	-	-	1	1	
3	Biochemistry	-	1	1	-	-	2	
4	Cardiothoracic Surgery*	1	-	-	-	-	1	
5	Community Medicine	1	-	-	-	-	1	
6	ENT	1	1	-	-	-	2	
7	Forensic Medicine	-	-	1	-	-	1	
8	General Medicine	1	1	-	1	-	3	
9	General Surgery	-	-	-	-	1	1	
10	Microbiology	1	-	-	-	-	1	
11	Nephrology*	-	-	1	-	-	1	
12	Neurosurgery*	-	1	-	-	-	1	
13	Nuclear Medicine	1	-	-	-	-	1	
14	Obstetrics & Gynecology	1	1	-	-	-	2	
15	Ophthalmology	1	-	1	-	-	2	
16	Orthopedics	-	1	-	-	1	2	
17	Paediatric Surgery*	1	-	-	-	-	1	
18	Paediatrics	1	-	-	1	-	2	
19	Pathology	-	1	-	-	-	1	
20	Physical Medicine and rehabilitation	-	-	1	-	-	1	
21	Physiology	1	-	-	-	-	1	
22	Psychiatry	1	-	-	-	-	1	
23	Pulmonary Medicine*	-	1	-	-	-	1	
24	Radiodiagnosis	-	-	1	-	1	2	
25	Radiotherapy	1	-	-	-	-	1	
26	Surgical Oncology *	-	1	-	-	-	1	
27	Transfusion Medicine and Blood Bank	1	-	-	-	-	1	
28	Trauma & Emergency#	1	1	-	-	-	2	
29	Urology*	-	-	1	1	-	2	
	Total	16	11	07	04	04	42	
For	details like Application Form Eligibility (Critoria et	c and for a	ny info/un	dates Die	ace vicit o	ur wohoit	

For details like Application Form, Eligibility Criteria, etc and for any info/updates. Please visit our website https://aiimsnagpur.edu.in/recruitment notices.

Executive Directo

HDFC BANK

HDFC Bank Ltd., 3rd Floor, Shivalik - III, Above Axis Bank, Near Drive In Cinema, Ahmedabad - 380054. Ph : 079 - 61738096, Mo. 9327974575

POSSESSION NOTICE

The undersigned being the Authorized Officer of the HDFC Bank Limited under th Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of Powers conferred under Section 13(2) read with the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice date 29.01.2021 calling upon the Interest (Enrorement) Nules, 2002, issued a demand notice date 29.01, 2021 calling upon the Borrowers 1) Cambay Industries A Proprietorship Firm Through It's Proprietor Rakesh Rajnikant Pandya 2) Rakesh Rajnikant Pandya to repay the amount mentioned in the notice being Rs.1,57,59,875.60 (Rupees One Crore Fifty Seven Lakh Fifty Nine Thousand Eight Hundred Seventy Five and Sixty Paisa Only) as on 28.01.2021 with further interest and expenses within 60 days from the date of notice of the said notice in their Overdraft Facility Account No. 50200005553766.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Actread with Rule 8 of the said Rules on this **04th Day of September of the year 2023.**

The Borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **HDFC Bank Limited** for an amount of **Rs. 2,50,04,413.66** as on **28.02.2022** and interest & expenses thereon untill the full payment. The Borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured

DESCRIPTION OF IMMOVABLE PROPERTY

All that piece and parcel of Industrial Property bearing Plot No. 1801/1 of land admeasuring 1088.47 Sq. Meters known as "Cambay Industries" consisting of Revenue Survey No. 21 & 22/Paikee in the Chhatral GIDC Estate within the village limits of Chhatral in Taluka: Kalol, District: Gandhinagar, Chhatral—382729 and The Property is owned by Cambay Industries. East: Plot No. 1801, West: 16.00 Meters wide road, North: 16.00 Meters wide road, South

Date: 04.09.2023, Place: Chhatral - Gandhinagar

Authorised Officer, HDFC Bank Ltd.

GUJARAT COTEX LIMITED

Regd.Office: Shop No. 4, 1st Floor, Shanti Complex, Opp. Patel Petrol Pump, Amli, Silvassa 396230. Tele 91-261-2471788 Email: jayprabha@hotmail.com, Website: www.gujcotex.com Corporate Identity Number: L17119DN1996PLC000116 NOTICE OF ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE, RECORD DATE AND EVOTING

NOTICE IS HEREBY GIVEN that the Annual General Meeting of GUJARAT COTEX LIMITED will be held on Saturday, 30° September, 2023, at the Hotel Soubhagya Inn, Plot No. 116/3/1, Silvassa – Vapi Main Road, Amli, Silvassa 396230 at 09:30 a.m. Votice of the Meeting has been emailed to members whose email address is available and has been sen o others by prescribed mode. The notice along with annual report has also been placed on website of the

tice is further given that: The business proposed in the notice of AGM may be transacted through voting by electronic means. The e-voting shall commence on 27/09/2023 at 09.00 a.m.

- The e-voting shall commence on 27/09/2023 at 09.00 a.m The e-voting shall end on 29/09/2023 at 05.00 p.m.
- The cut-off date for entitlement of e-voting shall be 23/09/2023
- The persons who have acquired shares after dispatched of notice may obtain the login ID and password by sending a request at jayprabha@hotmail.com. Remote e-voting shall not be allowed beyond end of e-voting period. The Company is providing electronic voting facility from a place other than venue of AGM ("remote e-voting") provided by Central Depository Services (India) Limited (CDSL) to its members in respect of the business to be transacted at the ensuing AGM. A member may participate in Annual General Meeting even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in the meeting. A person whose name is recorded in the register of members or in register of beneficial owners maintained by the depositories as on cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well
- the depositions as on cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as voting in general meeting.

 The website address of the company is www.suncitysyntheticsltd.com and that of CDSL is www.evotingindia.com.

 The grievances connected with facility for e-voting by electronic means may be refer to Mr. Utpal Shah, Regional Officer, Ahmedabad, CDSL, 203/204, Abhishree Avenue, 2nd floor, Near Nehru Nagar Circle, S. M. Road, Ambavadi, Ahmedabad 380 015 at email: utpals@cdslindia.com, Tel.: 079-32936232.

NOTICE IS ALSO HEREBY GIVEN pursuant to Section 91 of the Companies Act, 2013 that the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from 24/09/2023 to 30/09/2023 (both days inclusive). For Gujarat Cotex Limited

Place: Surat Date: 07/09/2023

Shaileshkumar Jayantkumar Parekh (Managing Directo (DIN: 01246270)

RAJVI LOGITRADE LIMITED (Former Name: SURYAKRUPA FINANCE LIMITED)

CIN: L60200GJ1986PLC083845

Regd. Office: Plot No. 267, Ward 12/B, Gandhidham, Gujarat-370201 Email: investor@rajvilogitrade.com Website: www.rajvilogitrade.com Contact No: 9979898027

NOTICE OF 36th ANNUAL GENERAL MEETING, EVOTING AND BOOK CLOSURE Notice is hereby given that the 36th Annual General Meeting (AGM) of the Company will be held or Saturday, 30th September, 2023 at 10:00 A.M through video conference (VC)/ Other Audio Visual Means in compliance with applicable provisions of the Companies Act, 2013 and circulars issued

from time to time by the Ministry of Corporate Affairs. The Notice of AGM along with Annual Report for the F.Y. 2023-2024 has been sent in electronic mode on 08-09-2023 to all those Members whose email addresses are registered with the Company. Depositories. The same is also be available on the website of the company at www.rajvilogitrade.com and on BSE website www.bseindia.com

Pursuant to Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements), Regulations 2015, Notice is also given that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Saturday, 23rd September, 2023 to Saturday 30^{rh} September, 2023 (both days inclusive), for the purpose of AGM of the Company. Pursuant to provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, members holding shares either in phys ical form or dematerialized form, as on the cut-off date on 23™ September, 2023 have an option to vote electronically on the Ordinary and Special Business as set out in the notice of 36th AGM through electronic voting system of Central Depository Services (India) Limited. All the members are informed

1) The remote e-voting shall commence from Wednesday, 27th September, 2023 (10.00 AM) till Friday

29th September, 2023 (05:00 PM). The remote e-voting shall be disabled by CDSL thereafter. 2) The cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGM is 23'

September, 2023. 3) The procedure for e-voting and attending the AGM through VC/OAVM facility have been provided in the notice of the AGM. A member may participate in the AGM even after exercising his right to

vote through remote e-voting but shall not be entitled to vote again at the AGM Members who are holding shares in physical and their email address are not registered are requested to register the email address by providing details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate, PAN card and Adhar card by email to company at investor@rajvilogitrade.com or to RTA at rnt.helpdesk@linkintime.co.in. Demat shareholders can update their email address with Depository Participant. Any person, who acquires shares of the Company and becomes member of the Company after dispatch of the notice and holding shares as of the cut-off date i.e. Saturday, 23rd September, 2023, may obtain the login ID and password

by sending a request at helpdesk.evoting@cdslindia.com. If you have any queries or issues regarding attending AGM & e-Voting from the CDSL e-Voting System, you can write an email to helpdesk.evoting@cdslindia.com or contact (022-23058738) or (022-23058542/43)

For, Rajvi Logitrade Ltd. Narendrasinh Rana

Place: Gandhidham Date: 08/09/2023

(Director)

KEMISTAR CORPORATION LIMITED 604, Manas Complex, Near Jodhpur Cross Road, Satellite, Ahmedabad - 380015, Gujarat.

(the Company) is schedule to be held on Friday, September 29, 2023 at the registered office of the Company at 604, Manas Complex, Jodhpur Cross Road, Satellite, Ahmedabad, Gujarat-380015 at 12:00 P.M. through Video Conferencing ('VC') facility/other audio visual means ('OAVM') to transact the businesses as set out in the Notice of AGM.

have registered their Email address with the Company/ Depository Participants on September 01, 2023. The requirement of sending physical copies of the Notice of the AGM has been dispensed with vide MCA Circulars and the SEBI Circular.

A Member can also download the Annual Report and the Notice of AGM from the following link(s) www.kemistar.in or https/www.evoting.nsdl.com or request for a copy by writing to the Company Secretary at kemistarbse@gmail.com. The details required pursuant to the provisions of the Companies Act, 2013 and Rules made thereunder are given below:

Sr. No.	Particulars	Day	Date
1	Cut-off date to record the entitlement of the shareholders to cast their vote electronically	Friday	22.09.2023
2	Date and time of commencement of voting through electronic means	Tuesday	26.09.2023 (09:00 A.M.) IST
3	Date & time of end of voting through electronic means	Thursday	28.09.2023 (05:00 P.M.) IST
4	Contact Details, in case of any query / grievance related to E-voting		National Securities Depository Limited Ms. Pallavi Mahtre Email id- evoting@nsdl.co.in Website www.evoting.nsdl.com Toll free no : 1800-222-990/1800224430

The remote e-voting will be disabled at 05.00 p.m on September 28,2023. Once the vote is cast by the Member on a

resolution, Member shall not be allowed to change the same subsequently. Any person, who acquires shares of the Company and becomes a Member of the company after dispatch of the Notice and is holding shares as on the cutoff date: i.e. September 22, 2023 may obtain the User ID and password by sending a request at evoting@nsdl.co.in. However if a person is already registered with NSDL for e-voting then existing User ID

allowed to vote again at meeting.

Pursuant to Section 91 of the Companies Act, 2013 read with Rule 10 of Companies (Management and Administration)

Sd/-Mr. Ketankumar Patel

Managing Director (DIN No. 01157786)

Date: September 07, 2023

Place: Ahmedabad

under project category "B" as mentioned in their request application.

Pollution Control Board before the hearing date.

Other concerned persons having a plausible stake in environment aspects of the

Circle, Sector - 10A, Gandhinagar, Gujarat - 382010

The District Magistrate /District Collector / Deputy Commissioner or his/her

The Public Hearing is scheduled to be held on 10/10/2023 at 11:00 Hrs, Venue: Plot No. 187/P & 187/P/1/B/2, 187/P & 187/P/1/B/3, 187/P &

D. M. Thaker 08/09/2023

"IMPORTANT" Whilst care is taken prior to

any manner whatsoever.

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY/IES)

The borrower/s having failed to repay the amount, notice is hereby given to the borrower/s and the public in general that the undersigned has taken possession of the property/les described herein below in exercise powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on the dates mentioned against each account.

Place: Gujarat

अखिल भारतीय आयुर्विज्ञान संस्थान, नागपुर, महाराष्ट्र

Authorized Officer (Motilal Oswal Home Finance Limited)

Number of Vacancy

CIN: L24233GJ1994PLC022845 Email: kemistarbse@gmail.com Web: www.kemistar.in Notice is hereby given that Twenty Nineth Annual General Meeting (AGM) of the Members of Kemistar Corporation Limited

The Company has completed the dispatch of Annual Report for FY 2022-23on September 06, 2023 along with the $Notice\ convening\ the\ AGM,\ E-voting\ and\ video\ conferencing/\ OVAM\ instructions\ through\ Email\ to\ those\ Members\ who$

- 1	oi. ito.		Day	Dato
	1	Cut-off date to record the entitlement of the shareholders to cast their vote electronically	Friday	22.09.2023
	2	Date and time of commencement of voting through electronic means	Tuesday	26.09.2023 (09:00 A.M.) IST
	3	Date & time of end of voting through electronic means	Thursday	28.09.2023 (05:00 P.M.) IST
	4	Contact Details, in case of any query / grievance related to E-voting		National Securities Depository Limited Ms. Pallavi Mahtre Email id- evoting@nsdl.co.in Website www.evoting.nsdl.com Toll free no.: 1800-222-990/1800224430

and password can be used for casting vote. A Member may participate in the AGM even after exercising his right to vote through remote e-voting but shall not be

Rule, 2014, the Register of Members and Share Transfer Books of the Company, will remain closed from September 23, 2023 to September 29, 2023 (both days inclusive). For Kemistar Corporation Limited

Ahmedabad

Satishkumar Maniya Chairman and Managing Director

(DIN: 02529191)

